

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૪/૦૭/૨૦૧૭ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

અમદાવાદ શહેર પોલીસ તરફથી કરવામાં

આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી :-

સમાચાર યાદી નં.૧૩૬૪/૧૭

બી ડીવીઝન:-

મદદનીશ પોલીસ કમિશ્નર "ખ" વિભાગ, અમદાવાદ શહેર શ્રી એ.કે.પરમાર નાઓએ તેમના ડીવિઝનમાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ શોધવા તથા અટકાવવા સારૂ તેમની કચેરી ના સ્ટાફના મ્હાસો ને સુચના આપેલ જે આધારે સ્ટાફના માણસો તા:૩/૭/૧૭ ના રોજ ડીવિઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળેલ અને ગુજ.યુ.નિ પોસ્ટે વિસ્તારમાં ફરતા ફરતા દાદા સાહેબના પગલા ચાર રસ્તા પાસે આવેલ જ્યાં દાદા સાહેબના પગલા ચાર રસ્તાની ગલીમાં ત્રણ ઇસમો કાપડના પોટલા સાથે જતા જણાવેલ. જેથી સ્ટાફના માણસોએ ત્રણેયને રોકી ત્રણેયના નામ ઠામ પુછતાં (૧) શાહબાજ દિલાવરખાન બલોચ ધંધોરીક્ષા ડ્રાઇવીંગ, રહે-શાહ આલમ દરવાજાની આગળ, અમ્મા મસ્જીદની સામે, બસીર કીરાણા સ્ટોરની આગળ (૨) સિકંદર બ્રિજલાલસિંગ રાજપુત ધંધોરીક્ષા ડ્રાઇવીંગ, રહે-મ.નં-૧૩૩, સાંઈ ફ્લેટ, છોટાલાલ, નવરંગ સ્કુલની સામે, વિરાટનગર અમદાવાદ મુળ વતન-ગામ-ફરતકાબાદ, આ:કાઇમગંજ, દિકંદરપુર ઉત્તરપ્રદેશ (૩) આફતાબ અસફાક અહેમદ શેખ ધંધોવેપાર, રહે-બ્લોક નં-૮૮, જુના બાપુનગર, અમનચોક, બાપુનગર અમદાવાદનું જણાવેલ જેઓની પાસેના કાપડના પોટલા ખોલાવતાં તેમાંથી કોટન પેન્ટ, જીન્સ પેન્ટ, જીન્સના કાપડ, કોટન કાપડ મળી આવેલ જે પેન્ટ તથા કાપડ બાબતે ત્રણે ઇસમોને પુછતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહીં અને બિલ માંગતા બિલ પણ નહીં હોવાનું જણાવેલ. જેથી તેઓને વિશ્વાસમાં લઇ પુછતાં તેઓએ જણાવેલ કે આ કપડા તથા પેન્ટ દાણીલીમડા પો.સ્ટેની હદમાં આવેલ નારોલ સર્કલ, કાશીરામ મિલની ગલીમાં એક ગોડાઉનમાંથી ચોરેલ અને અત્રે વેચવા આવેલ છે જેથી ત્રણ આરોપીઓને રૂ-૫૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી સી.આર.પી.સી ૪૧(૧)(ડી) મુજબ અટક કરવામાં આવેલ. અને દાણીલીમડા પો.સ્ટે ફ.ગુ.ર.નં-૭૪/૧૭ ઇપીકો કલમ ૪૫૪,૪૫૭ ના કામે સદર ચોરી બાબતે ગુનો દાખલ થયેલ હોય, સદર ચોરી કરેલ આરોપીઓ તથા મુદ્દામાલ દાણીલીમડા પોસ્ટે સોંપેલ છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અમદાવાદ શહેર.
પોલીસ કમિશનર વતી.